



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨૯/૦૮/૨૦૧૯ ગુરુવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૪૫૪/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૩૮ કેસ કરી, ૩૫ વ્યક્તિઓને ઝડપી, ૯૪ લીટર દેશી દારૂ, ૧૪૯૨ બોટલ ઇંગ્લીશ દારૂ, ૩૨ ક્વોર્ટર ઇંગ્લીશ દારૂ, ૬૦ બિયર ટીન, ૦૧ સ્કુટર અને ૧ લકઝરી બસ કબજે કરી હતી.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૪૫૫/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૪૭ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રો.ઈ.૯૩ હેઠળ ૦૮ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

સોનાની ચેઇન ખેચી તોડી લઇ ગયા :-

સમાચાર યાદી નં.૧૪૫૬/૧૯

શાહીબાગ: સુશીલાદેવી વા/ઓ મહેન્દ્રકુમાર છાવસરીયા (ઉ.વ.૭૩)(રહે.નેબુલા ટાવર ગેલેક્ષી ટાવરની અંદર બોડકદેવ) તા.૨૮/૦૮/૧૯ રાતના ૮/૧૦ વાગ્યાના સુમારે શાહીબાગ રાણી શક્તિ મંદીર આગળ ઉભા હતા દરમ્યાન એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરૂષ (૨૨ થી ૨૫ વર્ષના આશરાના) સુશીલાદેવીના ગળામાંથી સોનાની ચેઇન કિંમત રૂપિયા ૭૦,૦૦૦/- ખેચી તોડી લઇ નાસી ગયા હતા. આ અંગેની ફરીયાદ સુશીલાદેવી છાવસરીયાએ શાહીબાગ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એસ.એ.દેસાઇ ચલાવે છે.

ચોરી :-

સમાચાર યાદી નં.૧૪૫૭/૧૯

સરખેજ: બિરેનભાઈ બાબુલાલ પટેલ (રહે.ઓરમ સ્કાય ફ્લેટ, સાયન્સ સીટી રોડ, સોલા) એ સરખેજ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૮/૦૮/૧૯ સાંજના ૫/૩૦ થી ૫/૪૫ વાગ્યા દરમ્યાન બોપલથી શીલજ તરફ સ્મિત ગન હાઉસ સામે, બોપલ બ્રીજના નીચે પાર્ક કરેલ પોતાની કારના દરવાજાનો કાચ તોડી અજાણી વ્યક્તિ કારમાંથી રોકડ રૂપિયા ૨,૦૦,૦૦૦/-, લેપટોપ કિંમત રૂપિયા ૨૦,૦૦૦/- તથા બેંકની ચેકબુક ચોરી કરી લઇ ગઇ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એન.પી.સોનારા ચલાવે છે.

ટ્રેઇનની અડફેટે આવી જતા મૃત્યુ :-

સમાચાર યાદી નં.૧૪૫૮/૧૯

ખોખરા: જયશ્રીબહેન વા/ઓ અલ્પેશસિંગ મોર્ય (ઉ.વ.૪૩)(રહે.સર્વોદય સોસાયટી, ખોખરા) તા.૨૮/૦૮/૨૦૧૯ ના કલાક ૧૦/૦૦ વાગ્યાના સુમારે મણીનગર રેલ્વે સ્ટેશન પ્લેટ ફોર્મ નંબર-૨ અમુલ પાર્લર સામે ટ્રેઇનની અડફેટે આવી જતાં ગંભીર ઇજા થતા તેમનું મૃત્યુ નિષ્કળ હતું. આ અંગે ખોખરા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી બી.કે.વાઘેલા ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.